



જનસંપર્ક અધિકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૨/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૫૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૭ કેસ કરી, ૨૮ વ્યક્તિઓને ઝડપી, ૮૧ લીટર દેશી દારૂ, ૧૫૬ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧ કાર અને ૨ સ્ફટક કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૩ કેસ કરી, ૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૨,૯૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૬૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૨૬૧/૧૯

વાસણા: હરીતભાઈ જયદેવભાઈ સરૈયા (રહે. વિશ્વરેખા સોસાયટી જીવરાજ ચાર રસ્તા જીવરાજ પાર્ક) એ તા.૦૮/૦૨/૧૯ નારોજ વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૦૧/૧૯ કલાક ૧૦/૦૦ થી તા.૦૫/૦૨/૧૯ બપોરના ૨/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનની બારીની ગ્રીલ કાઢી તેમજ બેડરૂમના નકુચા તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, સોના-ચાંદીના દાગીના, ચાંદીના સીક્કા, ગોદરેજ કંપનીની તીજોરી અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૩૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.આર.તડવી ચલાવે છે.

સરખેજ: સંકેત બિપિનચંદ્ર સોની (રહે.પાર્વતી નંદન ફ્લેટ ઉજાલા સર્કલ પાસે સરખેજ) એ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૭/૦૨/૧૯ સાંજના ૬/૩૦ થી તા.૦૮/૦૨/૧૯ કલાક ૬/૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન સરખેજ ઉજાલા સર્કલ પાછળ ગોકુલમ ફ્લેટની નીચે આવેલ દુકાન નંબર-૭ ની "તીશા જવેલર્સ" નામની દુકાનનું શટરનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી, આશરે ૭ કિલો ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૧,૭૫,૦૦૦/- તથા સોનાની નથ-ચેઈન સાથેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-, વિડિયોકોન કંપની એલ.ઈ.ડી ટી.વી. કિંમત રૂપિયા ૧૫,૦૦૦/-, સીસીટીવી કેમેરાનું ડીવીઆર કિંમત રૂપિયા ૫૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૨૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.કે.પંડયા ચલાવે છે.

સાબરમતી: ઓલ્વીન સેમ્યુલ કિશ્ચયન (રહે.જુની કિશ્ચયન સોસાયટી જુના ચર્ચ પાસે મણીનગર પુર્વ) એ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૦૮/૦૨/૧૯ કલાક ૩/૦૦ થી ૧૧/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન સાબરમતી ત્રાગડ રોડ ગણેશા મંદીરની બાજુમા શિવદર્શન સોસાયટી ખાતે આવેલ પોતાના મકાનના દરવાજો તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, ડી.વી.આર. તથા સોનાના અને ડાયમંડના દાગીના (જેની કિંમતની ખબર નથી તે) તેમજ રોકડ રૂપિયા ૭૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી આર.એચ.વાળા ચલાવે છે.

નરોડા: જયંતીભાઈ બાલુભાઈ પરમાર (રહે. શ્રદ્ધાપાર્ક સોસાયટી, સેજલપાર્ક સોસાયટીની બાજુમા નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૦૭/૦૨/૧૯ કલાક ૧૨/૦૦ થી તા.૦૮/૧૨/૧૯ કલાક ૮/૪૫ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનો નકુચો તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, ત્રીજેરીમાંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- અને રોકડ રૂપિયા ૩૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૯૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.વી.સોલંકી ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૬૨/૧૯

સોલા હાઇકોર્ટ: ગોકુલભાઈ રામાભાઈ ભરવાડ (રહે. વૃંદાવન રો હાઉસ વિશ્વકર્મા મંદીર પાસે ચાંદલોડીયા) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે કે તા.૮/૨/૧૯ રાતના ૨/૦૦ વાગ્યાના સુમારે ઓગણજ સ્વસ્તીક એલીગંસ કર્ણાવતી આખંની હોસ્પિટલ સામેથી ત્રણ પુરૂષો સ્લેબ લગાવા માટેના સેંટીગના નાના-મોટા આશરે કુલ-૬૦૦ ફર્મા કિંમત રૂપિયા ૧,૯૯,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.ડી.પટેલ ચલાવે છે.

ચોથા માળેથી પડી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૨૬૩/૧૯

ઘાટલોડીયા: શૈલેષભાઈ સોનાજી ઠાકોર (ઉ.વ.૪૫) (રહે. પાર્થ એવન્યુની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં કાયા છાપરામાં ઘાટલોડીયા ગામ) તા.૮/૨/૧૯ બપોરના ૧૨/૧૦ વાગ્યાના સુમારે સુલવ એપાર્ટમેન્ટના ચોથા માળે કલરકામ કરતો હતો ત્યારે દોરડુ તુટી જતા નીચ પડતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાનતેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે ઘાટલોડીયા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી કમલેશભાઈ કાળાભાઈ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૬૪/૧૯

શહેરકોટડા: નારણભાઈ ભગવાનભાઈ મકવાણા (ઉ.વ.૫૫) (રહે. અનિલ વકીલની ચાલી રામાપીરનાં મંદિર પાસે પ્રેમનગર મેમ્કો) એ બિમારીથી કંટાળી તા.૮/૨/૧૯ બપોરના ૩/૧૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતની પાઈપ સાથે દોરી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ મ.સ.ઇ. શ્રી રાકેશકુમાર ત્રિભોવનભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.